

વિનંતી :

- (૧) અરજદારશ્રી મંજુલાબેન હમીરસિંહ ઉર્ફે દાયમા માલતીબેન જનકસિંહ રહે.મુ.ભોલાવ તા.જી.ભરૂચ તથા વિજયસિંહ જોડભા ચુડાસમા રહે.વેજલપુર અમદાવાદ C/O ન્યુ માર્ટી ટ્રેડર્સ, ટેલીફોન એક્ષચેન્જ સામે, જુનાબજાર કરજણની તા.૦૨/૦૩/૧૭ ના રોજની અરજી.
- (૨) મામલતદારશ્રી કરજણનાં પત્ર નંબર જમીન/વશી/૧૦૧૮/૨૦૧૭ એસઆર ૨૫/૧૭ તા.૧૭/૦૫/૨૦૧૭ થી આવેલ દરખાસ્તનાં કાગળો.
- (૩) નાયબ કલેક્ટર (જ.સુ.) વડોદરાના પત્ર નં.ટેનન્સી/એન.એ./એસઆર/૧૦૬/વશી/૮૪૫/૨૦૧૭ તા.૧૭/૦૬/૨૦૧૭
- (૪) જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫
- (૫) જમીન મહેસુલ નિયમોનાં નિયમ-૮૧(૨)
- ગુજરાત સરકાર, મહેસૂલ વિભાગના, ઠરાવ ક્રમાંક: બખપ/૧૦૦૬/૪૨૫/ક, તારીખ: ૧-૭-૨૦૦૮
- જમીન સંપાદન અધિકારી નર્મદા યોજના વડોદરાના પત્ર નં.જસં/નયો/વડોદરા/વશી/ એસઆર/૨૩૩/૨૦૧૭ તા.૧૫/૦૩/૨૦૧૭ ના પત્ર
- નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી એકમ-૧, વડોદરાના પત્ર નં.જસં/વળતર/વશી/૨૭૨/૨૦૧૭ તા.૦૪/૦૪/૨૦૧૭ ના પત્ર
- મંજરનિયોજકશ્રી, વડોદરાના હુકમ નં.બીપી/કરજણ/૨૧૪ તા.૦૪/૦૨/૧૭
- (૧૧) અરજદારશ્રી તરફથી એસ.બી.આઈ;કરજણ શાખા ખાતે તા.૦૩/૦૭/૨૦૧૭ ના રોજ મરપાઈ વધેલ રૂ.૧૬૫૮૦/- ના ચલણની નકલ

હુકમ :

- (૧) મોજે કરજણ તા.કરજણ જિ.વડોદરાના સ.નં.૬૫૫/૧ ની ૦.૬૧.૭૧ તથા સ.નં.૬૫૫/૨ ની ૦.૨૧.૨૪ મળીને કુલ ક્ષે.૦.૮૨.૯૫ ચો.મી વાળી ખેતીની જમીનની અરજદારશ્રી મંજુલાબેન હમીરસિંહ ઉર્ફે દાયમા માલતીબેન જનકસિંહ રહે.મુ.ભોલાવ તા.જી.ભરૂચ તથા વિજયસિંહ જોડભા ચુડાસમા રહે.વેજલપુર અમદાવાદ C/O ન્યુ માર્ટી ટ્રેડર્સ, ટેલીફોન એક્ષચેન્જ સામે, જુનાબજાર કરજણ જિ.વડોદરા ના ખાતે ચાલે છે. તે આ જમીન રહેણાંકના હેતુ માટે બીનખેતીની પરવાનગી મળવા વંચાણ-૧ થી અત્રે અરજી કરી છે.
- (૨) માલિકી હકકપણા(ટાઈટલ) બરાબર છે જમીનના માલિકીપણા અંગે કેસ, વિવાદ કે અપીલ ચાલુમાં નથી તેમજ જમીનમાં કોઈ સરકારી લેણું વસુલ લેવાનું બાકીમાં નથી તેમ મામલતદારશ્રીએ વંચાણ-૨ થી જણાવેલ છે.
- (૩) નાયબ કલેક્ટર (જ.સુ.) વડોદરાના પત્ર નં.ટેનન્સી/એન.એ./એસઆર/૧૦૬/વશી/૮૪૫/૨૦૧૭ તા.૧૭/૦૬/૨૦૧૭ ના પત્ર અન્વયે સવાલવાળી સ.નં.૬૫૫/૧ વાળી જમીનના રજુ થયેલ સને ૧૯૫૧-૫૨ થી ૭/૧૨ ની નકલો જોતાં બીજા હકકમાં કોઈ ગણોતીયા નોંધાયેલા નથી. પાણીપત્રકે સને ૧૯૫૧-૫૨ માં હરમાનભાઈ દાદાભાઈ ખુદ દર્શાવી ખેડની રીત-૨ સને ૧૯૫૨-૫૩ નું પાણીપત્રકની વિગત અવાચ્ય છે. ત્યારબાદ સને ૧૯૫૩-૫૪ થી "ખુદ" દર્શાવી ખેડની રીત-૨ તથા ૧ થી પાણીપત્રક થયેલ છે.

સવાલવાળી સ.નં.૬૫૫/૨ વાળી જમીનના રજુ થયેલ સને ૧૯૫૧-૫૨ થી ૭/૧૨ ની નકલો જોતાં બીજાહકકમાં કોઈ ગણોતીયા નોંધાયેલા નથી. પાણીપત્રકે સને ૧૯૫૧-૫૨ થી ૫૨-૫૩ સુધી પાણીપત્રક થયેલ હોવાનું જણાતું નથી. સને ૧૯૫૩-૫૪ માં હરમાન દાદાભાઈ દર્શાવેલ છે.ખેડની રીત દર્શાવેલ નથી. ત્યારબાદ સને ૧૯૫૪-૫૫ થી "ખુદ" દર્શાવી ખેડની રીત-૨ તથા ૧ થી પાણીપત્રક થયેલ છે. જેથી ગણોતીયાનો પ્રશ્ન નથી.

અરજદારશ્રી (૨) મંજુલાબેન હમીરસિંહ ઉર્ફે દાયમા માલતીબેન જનકસિંહ ના વડીલશ્રી હમીરસિંહ ગંભીરસિંહ મોજે કરસાડ તા.વાલીયા જિ.ભરૂચના સ.નં.૧૮૬ પૈકી વાળી જમીન કબજા હકકની નોંધ નં.૧૫/૧૧/૫૧ થી ધરાવે છે. ત્યારબાદ વારસાઈની નોંધ નં.૮૩૭ તા.૨૦/૧૧/૮૭ થી અરજદારશ્રી મંજુલાબેન હમીરસિંહ ગંભીરસિંહના દિકરી વિ.ના નામો દાખલ થયેલા.આમ, ઉપરની વિગતે બંને અરજદારશ્રીઓ ખેડૂત ખાતેદાર હોવાનું જણાય છે. સવાલવાળી જમીન જૂની શરતની છે. જેથી ગણોત્તદારા હેઠળ મંજુરી લેવાનો પ્રશ્ન નથી.

- (૪) મામલતદારશ્રી, કરજણના પત્ર નંબર જમીન/વશી/૧૦૧૯/૨૦૧૭ એસઆર ૨૫/૧૭ તા. ૧૭/૦૫/૨૦૧૭ અહેવાલ- વ- અભિપ્રાય નજરે અરજદાર પોતે જમીનના માલિક છે. સવાલવાળી જમીન જુનીશરતની છે. સવાલવાળી જમીનના માલિક પણા અંગે કોઈ કેસ ચાલતો નથી. અપીલ કે વિવાદ ચાલતો નથી. કે પડતર નથી. સ્થળે કબજો ભોગવટો અરજદારનો છે. કે સવાલવાળી જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી ચાલતી નથી. પ્રશ્ન હેઠળની જમીન શહેરી જમીન ટોચ મર્યોદા ધારા હેઠળ સરકાર સંપ્રાપ્ત થયેલ નથી તથા પ્રશ્ન હેઠળની જમીન ગુજરાત ખેત જમીન ટોચ મર્યોદા કાયદો-૧૯૬૦ હેઠળ આવતી નથી. કબજેદારે પરવાનગી આપતાં ઠરાવવામાં આવે તે શરતો મુજબ વર્તવાં તથા ઠરાવે તે વિ. ધારો ભરવા સંમતિ જવાબ આપેલો છે. તથા રહેણાંક હેતુ દર ચો. મી. રૂ. ૦-૧૦ પૈસા પ્રમાણે તથા પ્રવર્તમાન દરે લોકલફંડ તથા શિક્ષણ ઉપકર અને રૂપાંતરકર ભરવાની શરતે બીનખેતી પરવાનગી આપવા ભલામણ કરેલ છે.
- (૫) આ જમીન સંપાદનની કાર્યવાહી હેઠળ નથી એવું જમીન સંપાદન અધિકારીશ્રીઓએ જણાવેલ છે.
- (૬) ખાતેદારે રહેણાંક ના દર ચો. મી. રૂ. ૨-૦૦ પ્રમાણે ક્ષે. ૦.૮૨.૯૫ ચો. મી. ચો. મી. જમીનના રૂપાંતરકરની રકમ રૂ. ૧૬૫૯૦/- (અંકે રૂપીયા સોળ હજાર પાંચસો નેવું પુરા) સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરજણ શાખામાં "૦૦૩૫" સદરે તા. ૦૩/૦૭/૨૦૧૭ ના રોજ જમા કરાવી અસલ ચલન રજુ કરેલ છે. તેમજ અગાઉ જીલ્લા નીરીક્ષકશ્રી જમીન દફતર વડોદરા ધ્વારા માપણી કરાવી માપણી શીટની નકલ રજુ કરેલ છે.
- (૭) સબજ, મોજે કરજણ તા. કરજણ જિ. વડોદરાના સ. નં. ૬૫૫/૧ ની ૦.૬૧.૭૧ તથા સ. નં. ૬૫૫/૨ ની ૦.૨૧.૨૪ મળીને કુલ ક્ષે. ૦.૮૨.૯૫ ચો. મી. વાળી જમીનના પત્રક મુજબ રહેણાંકના રૂ. ૦-૧૦ પૈસા પ્રમાણે રૂ. ૮૩૦/- વિ. ધારો તથા અન્ય ઉપકરો પ્રવર્તમાન દરે તા. ૧/૮/૨૦૧૭ થી બીજો હુકમ થતાં સુધી દર વર્ષે ભરવાની થાય છે. તથા ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક બખપ/૧૦૦૬/૪૨૫/ક તા. ૮/૪/૨૦૧૧ અન્વયે સક્ષમ અધિકારી પાસે મંજૂર નકશા અને શરતો પ્રમાણે તથા નગરપાલિકા કરજણની રજાચિટ્ટી મેળવી બાંધકામ કરવાની શરતે બીનખેતીના રહેણાંકનાં હેતુ માટે પરવાનગી આપવા નીચેની વધુ શરતોને આધીન હુકમ કરવામાં આવે છે.

(૧) ધીરૂડી ઈન્ડોસ્ટર પોલ ટેન્કોના આસપાસ ઈસુ કરવાના નિયમો હેઠળ ઉપર મુજબ જાળવવાના હોય તેવા દર્શાવેલ લોવી જોઈએ. મંજૂર કરાયેલ પ્લાન તથા લે-આઉટ પ્લાન સહાય કક્ષાએ મંજૂર કરાવેલ હોવો જોઈએ.

(૨) બાંધકામ શરૂ કરતાં પહેલા બાંધકામના નકશા સહાય અધિકારી પાસે મંજૂર કરાવવાના રહેશે, પરંતુ અરજદાર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર આવા બાંધકામની રજા ચીકી મેળવી શકશે નહીં.

(૩) શહેરી વિસ્તાર જ્યાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થઈ ગઈ છે ત્યાં જી.ડી.સી. આર. અને ઝોનીંગના નિયમો અનુસાર બાંધકામ કરવાનું રહેશે.

(૪) મંજૂર થયેલ નકશા મુજબ આરોગ્ય અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગંદા પાણીના નિકાલની જોગવાઈ કરવાની રહેશે.

(૫) અરજદારે રીબન ડેવલપમેન્ટ રૂલ્સ નીચે જે તે રસ્તાનો પ્રકાર ધ્યાને લઈ રસ્તાના મધ્યબિંદુથી બાંધકામ વચ્ચે અંતર જાળવવાનું રહેશે અન્યથા અરજદારની જવાબદારી થશે.

(૬) ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી માંગેલ હોય તો બાંધકામ કરતાં પહેલા જિલ્લા ઉદ્યોગ અધિકારીની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.

(૭) ફ્લોર મીલ, સિનેમા/ટુરીંગ સિનેમા/ થીયેટર માટે બિનખેતી પરવાનગીના કામે જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.

(૮) પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સી.એન.જી., એલ.પી.જી. પંપ નાંખવા માટે બિનખેતી પરવાનગીના કામે બાંધકામ શરૂ કરતાં પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.

(૯) ઈન્ડિયન એક્સપ્લોઝીવ એક્ટ અન્વયે મેગેનીઝ, ફાયરવર્ક્સ, દારૂખાના માટે બિનખેતીની કાર્યવાહી કરતાં પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટની જરૂરી મંજૂરી મેળવી આગળની કાર્યવાહી કરવાની રહેશે.

(૧૦) સવાલવાળી જમીન જો જેલથી નજીક હોય તો ૧૮૪ મીટરનું અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.

(૧૧) સવાલવાળી જમીન જો રેલ્વે હદની નજીક હોય તો રેલ્વેની હદથી ૩૦ મીટર જગ્યા છોડી બાંધકામ કરવાનું રહેશે.

(૧૨) સવાલવાળી જમીન ઉપરથી અથવા બાજુમાંથી વિજળી ગ્રીડના તાર/ હાઈટેન્શન પાવર અગર થાંભલા આવેલ હોય ત્યારે તે અન્વયે લાગુ પડતા નિયમોનું પાલન કરવા અને તે મુજબ બાંધકામ કરવાનું રહેશે.

(૧૩) બિનખેતી માંગવામાં આવી હોય તેવી જમીન જો એરોડ્રામ આસપાસના ૨૦ કી.મી.ની ત્રિજ્યામાં આવતી હોય ત્યારે બાંધકામની ઉચાઈ તથા એરોડ્રામની દ્રષ્ટિએ જરૂરી એવું 'ના વાંધા પ્રમાણપત્ર' સીવીલ એવીએશન ખાતા પાસેથી મેળવવાનું રહેશે અને સીવીલ એવીએશન ખાતાના નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧૪) ભારતીય વાયુસેનાના હવાઈ મથક તથા ઈન્સ્ટોલેશનથી ૮૦૦ મીટરની ત્રિજ્યા બહાર બાંધકામ કરવાનું રહેશે.

(૧૫) ઓ.એન.જી.સી.ના કુવા નજીકમાં આવેલ જમીનના કિસ્સામાં અરજદારે સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧૬) નર્મદા કેનાલ/અન્ય સિંચાઈ કેનાલની નજીકમાં આવેલ જમીનની બાબતમાં અરજદારે સૂચિત બાંધકામ માટે જાળવવાના થતાં અંતર અંગેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧૭) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા નીચે રક્ષિત સ્મારક (PROTECTED MONUMENTS) તરીકે જાહેર કરેલ પ્રાચીન સ્મારકથી ૧૦૦ મીટર સુધીનું અંતર જાળવવાની પ્રવર્તમાન જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

(૧૮) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં ભારતીય વન અધિનિયમ હેઠળ અનામત વન જમીન કે રક્ષિત વન તરીકે જાહેર કરેલ વન/જમીનથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

(૧૯) અરજદારે/જ્યાં જરૂરી હોય ત્યાં વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અન્વયે અભ્યારણ્ય અથવા રાષ્ટ્રીય ઉપવન તરીકે જાહેર કરેલ કોઈપણ વિસ્તારની હદથી જાળવવાના થતાં અંતર બાબતની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

(૨૦) અરજદારે ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમાં નિષ્ફળ જશે તો શરતભંગ ગણી સહાય અધિકારી કાયદેસરની કાર્યવાહી કરશે.

(૨૧) " વરસાદી પાણીના ભૂગર્ભ વહન/સંચય માટે દર મકાન/બહુમાળી મકાન (નકશા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તાતંત્રએ આપેલ મંજૂરી મુજબ) દીઠ એકના દરે પરકોલેટીંગ બોરની વ્યવસ્થા અચૂક કરવાની રહેશે. "

(૨૨) બાંધકામ શરૂ કર્યા તારીખથી એક માસમાં અને બાંધકામ પૂરું કર્યા તારીખથી એક માસમાં એમ બન્ને પ્રસંગોએ અત્રે લેખિતમાં જાણ કરવી પડશે.

(૨૩) આ જમીન ઉપરનું મંજૂર થયા પ્રમાણે બાંધકામ આ હુકમ થયા તારીખથી છ માસમાં શરૂ કરી ત્રણ વર્ષમાં પૂરું કરવાનું રહેશે. તેમ કરવામાં ચુક થયે કલમ-૬૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અને વસુલ ભરેલા વિ.ધારા વિગેરે કોઈપણ સંજોગોમાં પરત મેળવવાનો હકક રહેશે નહિ. આ અંગે અપીલનો સમય પૂરા થયા બાદ કોઈ વકફ રહેશે નહિ.

(૨૪) રજાચિત્તિ લેવાઉટ પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાનાં પ્રસંગે સહાય અધિકારીશ્રી નાયબ કલેક્ટરશ્રી હુકમ કરે તે સમયમાં દૂર કરવાનું રહેશે. અને તે વિરુદ્ધ વર્તન થયાનાં પ્રસંગે કબજેદારને અર્થે દૂર કરાવવામાં અને અર્થ જમીન મહેસુલ બાકી રહે વસુલ કરવાપાત્ર થશે અને નાયબ કલેક્ટરશ્રી કરાશે તે રૂંડ ભરવો પડશે.

(૨૭) નાગર નિરીક્ષકશ્રી નગર આયોજન અને મુલ્યાંકન પ્રાપ્ત વડોદરાના પત્ર ક્રમાંક:બીપી/કરજણ/૧/૨૦૧૭

તા. ૧૨/૦૭/૧૬ ના પત્રમાં જણાવ્યાનુસારની શરતોનો ચુસ્ત પાલન કરવાનું રહેશે
(૨૭) સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૧૧/૦૭/૭૨ ના ઠરાવ તથા પ્રવર્તમાન ઠરાવોની જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં ચૂક થશે તો સદરહું સરકારશ્રીએ નક્કી કરેલ રૂ. ૧૦૦૦/- ની ડીપોઝીટની રકમ સરકારશ્રીમાં જમા કરવામાં આવશે જેની નોંધ લેશો.



(કે.ડી.ભગત)

નાયબ કલેક્ટર કરજણ

રજી. પોસ્ટ એડી. થી

પ્રતિ,

(૧) શ્રી મંજુલાબેન હમીરસિંહ ઉર્ફે દાયમા માલતીબેન જનકસિંહ

રહે. મુ. ભોલાવ તા. જી. ભરૂચ

(૨) વિજયસિંહ જોડાભા ચુડાસમા

રહે. વેજલપુર અમદાવાદ C/O ન્યુ માર્ટી ટ્રેડર્સ, ટેલીફોન એક્ષચેન્જ સામે, જુનાબજાર કરજણ

નકલ જયભારત સહ રવાના :-

(૧) ચીફ ઓફીસરશ્રી, કરજણ નગરપાલિકા, કરજણ, જી. વડોદરા તરફ

(૨) મામલતદારશ્રી કરજણ તરફ (હુકમની નકલ બે પ્રતમાં)

એક પ્રત તાલુકા નમુના નં. ૪ માં ઉપજની નોંધ કરાવી ગામ દફતરે રાખવા મોકલવા તથા વિ. ધારાની રકમ સને ૨૦૧૬-૧૭ નાં હિસાબોમાં સાધવા તથા ગામે તા. નં. નં. ૨ તથા ૭/૧૨માં વિ. ધારાની નોંધ કરાવવા અને નિયમ પ્રમાણે આગળની તજવીજ કરવા સારું.

(૩) જિલ્લા નિરીક્ષકશ્રી, જમીન દફતર વડોદરા.


(૪) સીટી સર્વે સુપ્રિ. શ્રી કરજણ તરફ.

(૫) નાયબ નગર આયોજન અધિકારીશ્રી, નર્મદા ભુવન વડોદરા તરફ

મોજે કરજણ તા.કરજણ જિ.વડોદરાના સ.નં.૬૫૫/૧ ની ૦.૬૧.૭૧ તથા સ.નં.૬૫૫/૨ ની ૦.૨૧.૨૪ મળીને કુલ શે.૦.૮૨.૮૫ ચો.મી વાળી જમીનની

બીનખેતી હુકમ પરવાનગીનું પત્રક

બીનખેતી ની પરવાનગી માંગેલ જમીનો સ.નં.ક્ષેત્રફળ તથા કબજેદારનું નામ	બીન ખેતીની પરવાનગી માંગેલ જમીનનું ક્ષેત્રફળ	નિયમ મુજબ લેવાનો વિશેષ ધારાની રકમ	વસુલ કરવાની વિશેષધારા નીરકમ	રૂપાંતરકર લેવાની વિગત	શિક્ષણ ઉપકરની રકમ	લોકલ કંડ ની વિગત	કોલમ-૪ ની વિ.ધારો કઈ તારીખથી લેવાનો છે. તેની વિગત
૧	૨	૩	૪	૫	૬	૭	૮
મોજે કરજણ તા.કરજણ જિ.વડોદરાના સ.નં.૬૫૫/૧ ની ૦.૬૧.૭૧ તથા સ.નં.૬૫૫/૨ ની ૦.૨૧.૨૪ મળીને કુલ શે.૦.૮૨.૮૫ ચો.મી વાળી જમીનની બીનખેતી ગરજદારશ્રી મંજુલાબેન હમીરસિંહ ઉર્ફે દાયમા માલતીબેન જનકસિંહ તથા વિજયસિંહ જોરુમા ચુડાસમા વિ.	સ.નં.૬૫૫/૧ ની ૦.૬૧.૭૧ તથા સ.નં.૬૫૫/૨ ની ૦.૨૧.૨૪ ની કુલ શે.૦.૮૨.૮૫	રહેણાંક હેતુ માટે પ્રતિ ચો.મી ૦.૧૦ પૈસા	૮૩૦/-	રૂપાંતરકર ની દર ચો.મી. રૂા.૨-૦૦ પ્રમાણે શે.૦.૮૨.૮૫ ચો.મી.જમીનના રૂપાંતરકરની રકમ રૂા.૧૬૫૮૦/- (અંકે રૂપીયા સોળ હજાર પાંચસો નેવું પુરા) રેડેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરજણ શાખામાં "૦૦૩૫" સંદર્ે તા.૦૩/૦૭/૨૦૧૭ ના રોજ જમા કરાવી અસલ ચલન રજૂ કરેલ છે.	૨૦૮/-	૪૧૫/-	૦૧/૦૮/૨૦૧૭ થી વખતોવખત સુધારાને આધીન



(કે.ડી.ભગત)

નાયબ કલેક્ટર કરજણ